

November 14, 2019

To,

Department of Corporate Services,

BSE Limited

Ground Floor, P.J.Tower,

Dalal Street, Fort,

Mumbai- 400001

BSE Script Code: 541735

Dear Sir/Madam,

Sub: Copy of Advertisement of Standalone Unaudited Financial Results for the quarter and half year ended September 30, 2019

Please find enclosed herewith copy of Advertisement of Standalone Unaudited Financial Results for the Quarter and half year ended September 30, 2019 as per the Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper (Freepress Gujarat) and one daily newspaper (Lokmitra) in Gujarati language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking you,

Yours Faithfully,

For, Vivanta Industries Limited

Name: Parikh H.A.

Managing Director

DIN: 00027820

Encl: As above



CIN: U74110GJ2013PLC075393

Toyota Kirloskar Motorhosts the National Skill Festival 2019



Ahmedabad: Kirloskar Motor (TKM), in its constant endeavour towards developing skilled workforce across its dealer network in the country, todayconducted the 'National Skill Festival 2019' for all its dealership personnel across India. The event serves as a platform to reward exceptional sales, service, customer relations& U-Trust skillssettinginnovative skill

standards in the industry. In line with the company's commitment towards the Skill India initiative, the Skill Festivalis another step by Toyota who has been constantly engaged in initiatives to bridge the growing skill gap in the dynamically changing Indian industry. Held President. (20-4)

Toyota at three levels - across dealerships, In-dealer, regional and national levels, the contestants were assessed on various parameters such as knowledge process demonstration, soft skills and proficient role plays in providing

premium customer experience

and human touch among others. The event finale was attended by Mr. Atsushi Kimata, General Manager [Body & Paint Promotion Department, Customer First Promotion Group1 - Toyota Motor Corporation; along with the senior Management Executives of Toyota Kirloskar Motor Shekar Viswanathan, Vice Chairman;

and Mr. TadaoKidokoro, Vice

National Instructional Media Institute announced copyright free DGT study materials for all



ensure greater accessibility to students and teachers for necessary study materials, National Instructional Media (NIMI) today announced that all the books developed and printed by the institute for Directorate General of Training (DGT) will be made completely copyright free and put under CC BY license. A CC BYlicense helps an author to give other people the right to share, use, and build upon a work that they (the author) has created, if due credits provided.

Institute (NIMI) works on the made development of Instructional

Ahmedabad: In a bid to material, question banks for assessment and relevant digital content for the use by teachers and students. The material is designed keeping in mind both short and long term skill development courses carried out by DGT and other educational institutes.

The initiative will help others distribute and build up on their own work, even commercially, as long as it credits NIMI for the original creation. The objective is to help spread the books within larger audience for the benefit of students and National Instructional Media Therelevant content is being available www.nimilearningonline.in. (20-4)

Popular science lecture on A bird view of Periodic Table Progression by Dr. Rupesh Gaikwad



Ahmedabad: Gujarat Science City organised an interactive session as it continued celebrations 2019 International Year of Periodic Table of Chemical Elements. Dr. Rupesh Gayakwad, Assistant Professor, Maharshi Dayanad college, Department of Chemistry shared information about The periodic table which has become an icon of science.

The United Nations General Assembly during its 74th Plenary we should care about the Meeting proclaimed 2019 as the periodic table or elements in International Year of the Periodic

Table of Chemical Elements. With more than 100 school students in the audience, Dr Gayakwad started with handson activity to explain basics of Periodic table and its significance in today's world. As the session progressed he also detailed about contribution of various scientists towards Periodic Table. Dr Gayakwad, EC Member of National Centre for Science and Communication, explained why general.

Tata Starbucks and Penguin Random House India collaborate to launch a unique coffee themed novel

Ahmedabad: In a one of a kind partnership to launch bestselling author Harish Bhat's new book An Extreme Love of Coffee', Penguin Random House India collaborates withTata Starbucks.Celebrating the beautiful beverage that excites and sustains millions of Indians, young and old, for the first time ever in India, several outlets of TATA Starbucks across the country will be retailing this uniquenovel entirely inspired by

the romance of Indian coffee. Since the opening of our first Starbucks store in India back in 2012, our experience has been nothing short of extraordinary. We



are proud of India's rich coffee heritage and this novel captures thatessence beautifully. We are passionate about delivering the highest quality coffeehouse experience to our customers and believe that every 'moment' is a moment of connection and recognition. (19-10)

'Hindutva is not divisive, not anti-Muslim RSS will abide by the Supreme Court judgment on Ayodhya

SPECIALITY PAPERS LTD

BJP's political dominance, an attendant quest is to understand how RSS locates its ideology in 21st century India. How does it now view emotive issues such as Ram Janmabhoomi movement and uniform civil code (UCC) from its position as the ideological anchor of the ruling party? Sunil Ambekar, a pracharak in RSS and the national organising secretary of its students wing ABVP, has tried to articulate the organisation's current views through a book which details its world view. He speaks to Indrajeet Rai on the Sangh's viewpoint on issues old and new: Is Hindutva essentially

anti-Muslim? Hindutva is not divisive. It never was. It is a unifying factor. The 'tatva' in Hindutva always looks for unifying factors in different communities. In fact Hindus and Muslims have same ancestors. We may look different and may have different praying styles today, but our ancestors were the same

The RSS is not against Muslims. Sangh is against any kind of separatism. In fact, we opposed Partition. We wanted to keep Hindus and Muslims together. We are not against

Hindutva is not against any religion or any person, be it Muslims or Jews. The Sangh is against Islamic terror. Not only RSS, but the entire world, including Muslim-majority nations, are raising their voice against Islamic terror.

What about some important

VADODARA: On the heels of Hindutva concerns like Ram Janmabhoomi temple, cow protection, UCC and Article 370? Let's wait for the Supreme Court judgment on Ayodhya. We

have waited so long for the court verdict to build the Ram temple in Ayodhya. The RSS will abide by the SC judgment.

What if the SC verdict is not

(20.185)

15.616.410 15.616.410 15.616.410

406.476

399.182

156,400

15,616,410

Regd. office: Morai Village, (Opp. Morai Railway Phatak), N.H. No. 8, Vapi, Dist. Valsad-396101. Gujarat. T:022-22094033
CIN-L21010GJ1961TLC001073, Email: info@specialitypaperslimited.com, Website: www.specialitypaperslimited.com UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER / HALF YEARLY ENDED 30TH SEPTEMBER 2019 Year Ended Particulars 30/09/2019 | 30/06/2019 | 30/09/2018 | 30/09/2019 | 30/09/2018 (Unqudited) | (Unqudited) | (Unqudited) | (Unqudited) | 599.276 241.920 449.730 841.198 473.499 (a) Revenue from Operations 0.563 474.062 (b) Other Income TOTAL INCOME (A + B) 0.001 449.731 599.276 241.920 841.198 Cost of sales and other operations Purchase of Stock of trade 849.082 601.553 467,779 1.591.900 247,520 461,258 (2.506) 1.531 (2.294) 4.230 0.114 7.763 (4.801) 5.761 0.228 11.113 10.530 2.014 4.544 10.996 Changes in Inventories Employee Benefit Expenses 258,340 Other Expenses TOTAL EXPENSES 604.041 257.332 464.238 Profit/ (Loss) Exceptional items & (4.765)(20.185) (21.801) (41.720) (15,412) Taxes (1-2) (14.507) (4.765) (15.412) (20.185) (21.801)(41.720) (14.507) Profit/ (Loss) before tax (3-4) Tax Expense Current Tax (253.046) 231.245 Deferred Tax (4 765) (15 412) Profit/(Loss) for the period (5-6) (20.185) 238.539 308.380 i. Items that will not be reclassified to profit or loss 58,241 ii.Income tax relating to Items that will not be reclassified to profit or los Total Compresive Income

(0.001) The Above financial Result as received by audit committee were taken on record by Board of Directors at Board Meeting held on 11/11/19

15.616.410 15.616.410

(15.412)

(4.765)

Previous year figure have been regrouped/ rearranged wherever necessary The Company is engaged in the Business of Manufacturing, trading and other related product of Paper (Mr. Dayaram R. Sharma DIN 0787076 in favour of making a Ram temple? Whatever happens will be within the constitutional framework. We will explore all constitutional means to build the Ram temple. What about 'Yeh toh kewal ihanki hai. Kashi. Mathura baaki hai (Ayodhya was just a glimpse.

Corrigendum

Please refer to the Statement of Unaudited Financial Results (Standalone & Consolidated) for the quarter and half year endec 30th September, 2019 of Texel Industries Limited (CIN: L29100GJ1989PLC012576) published in Free Press Gujarat on November 13, 2019, pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (LODR).

Kindly note that the place of signing the above mentioned Financial Results has been inadvertently mentioned as Mumbai Ahmedabad in the aforementioned publication in place of Ahmedabad, due to printing error of the publisher.

VIVANTA INDUSTRIES LIMITED

Regd. Office: 403, Sarthik 2, Opp. Rajpath Club, S. G. Highway, Ahmedabad 380054.

CIN: U74110GJ2013PLC075393

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED SEDTEMBED 20 2010

SEPTEMBER 30, 2019.					
			(Rs. In Lacs)		
Particulars	Quarter ending	Year to date Figures	Correspondin g 3 months ended in the previous year		
	30/09/2019	30/09/2019	30/09/2018		
	Unaudited	Unaudited	Unaudited		
Total income from operations	0.00	0.00	39.91		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-13.35	-23.74	-0.83		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-13.35	-23.74	-0.83		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-13.35	-23.74	-0.83		
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]		-23.74	-0.83		
Equity Share Capital	1000.00	1000.00	1000.00		
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)					
Basic:	-0.13	-0.24	-0.01		
Diluted:	-0.13	-0.24	-0.01		
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualised)					
Basic : Diluted :	0.10	-0.24	0.04		
Diluted:	-0.13 -0.13		-0.01 -0.01		
	0.10	0.24	0.01		

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Reguirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www. bseindia.com) and the company's website (www. vivataindustries.com)

** ** overline from the dear the effective constant the enterior of the enteri	For, VIVANTA INDUSTRIES LIMITED
	SD/-
	PARIKH H.A.
Date: 12/11/2019	MANAGING DIRECTOR
Place : Ahmedabad	DIN:00027820

Hawa Engineers (td.

Total Compresive Income 7+8

Per Shares Earnings per Equity Share

Paid up Shares Capital Values 10

Registered office : Plot No. 129, Narol Road, Near Kashiram Textile Mill ,Ahmedabad ,Gujarat ,382405"1 Email: cs@hawaengltd.com II Website: www.hawaengltd.com II" II Phone: 079-25320781, 25320782 II CIN: L29120GJ1993PLC019199 II"

Sr. No.	Particulars	Ouarter ended	Half Year ended	in lakh except per share o Year Ended
SF. NO.	Particulars			
		30-09-2019	30-09-2019	31-03-2019
		UnAudited	UnAudited	Audited
1	Total income from operations (net)	1006.59	2329.91	5095.98
2	Net Profit/(Loss) for the period (before Tax,	33.61	73.54	104.72
	Exceptional and/or Extraordinary items)			
3	Net Profit/(Loss) for the period before Tax (after	33.61	73.54	104.72
	Exceptional and/or Extraordinary items)			
4	Net Profit/(Loss) for the period after Tax (after	33.61	73.54	73.56
	Exceptional and/or Extraordinary items)			
5	Total Comprehensive Income for the Period	33.61	73.54	73.56
	(Comprising Profit/(Loss) for the period (after tax)			
	and Other Comprehensive Income (after tax))			
6	Equity Share Capital	352.64	352.64	352.64
7	Other Equity(excluding Revaluation Reserve)	0.00	0.00	963.19
8	Earnings Per Share	0.95	2.09	2.09
0	(of ₹ 10/- each) (not annualised) Basic & Diluted		1	

The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the Compan in its meeting held on 13/11/2019 and same are also been reviewed by the statutory auditors of the Company

(Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites(www.bseindia.com) and on the Company website(www.hawaengltd.com)

	For, Hawa Engineers Ltd
	Sd/-
Place : Ahmedabad	Aslam F Kagdi
Date : 13th November, 2019	Managing Director
	DIN:00006879



SUNGOLD CAPITAL LTD

[CIN: L65910GJ1993PLC018956]

Regd off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla Narmada - 393145. Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064

Website: www.sungoldcapitallimited.com Email: info@sungoldcapitallimited.com

(Rs. In Lakhs, except per share					
Sr. no.	Particulars	Quarter ended	Year to date Figures/Previous Year ending	Three months ended in the previous year	
		30-09-2019	31-03-2019	30-09-2018	
		Unaudited	Audited	Unaudited	
1	Total Income from Operations	57.851	185.199	48.732	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	1.909	4.757	4.239	
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items#)	1.909	4.757	4.239	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	1.413	3.573	2.929	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1.413	3.573	2.929	
6	Equity Share Capital (Face value of Rs. 10/-)	1840.350	1840.350	1840.350	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	354.879		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -				
	(a) Basic	0.008	0.019	0.016	
	(b) Diluted	0.008	0.019	0.016	

The above result is reviewed by the Audit Committee at the meeting and approved by the Board of Directors at their meeting held on Tuesday November 12, 2019. The above is an extract of the detailed format of financial result filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Require ments), Regulations, and 2015. The full format of Financial Result is available on Stock Exchange website www.bseindia.com and on Company's website, www.sungoldcapitallimited.com.

The Company has three reportable segments which are NBFC, Entertainment and software development. For Sungold Capital Limited Sd/-

Rajiv Kotia Place: Mumbai (Chairman & Managing Director) DIN: 00135912 Date: 12.11.2019

HDB FINANCIAL SERVICES LIMITED HDB FINANCIAL SERVICES

Registered Office: Radhika, 2 nd Floor, Law Garden Road, Navrangpura, Ahmedabad, Gujarat, Pincode- 380009 Branch Office: 603,21st Century Building, Ring Road Surat, Gujarat PIN 395005

'UNDER SECTION 13 (2) OF THE SARFAESI ACT, 2002

You, below mentioned borrowers, co-borrowers and guarantors have availed loan(s) facility(ies) from HDB Financial Services Limited branch Surat & Gandhidham, by mortgaging your immovable properties (securities) you have not maintained your financial discipline and defaulted in repayment of the same. Consequent to your defaults your loans ere classified as non-performing assets as you to avail the said loan(s) along with the underlying security interest created in respect of the securities for repayment of the same. The HDBFS has right for the recovery of the outstanding dues, now issued demand notice under section 13(2) of the securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 (the Act), the contents of which are being published herewith as per section 13(2) of the act read with rule 3(1) of the security interest (enforcement) rules, 2002 as and by way of alternate service upon you. Details of the Borrowers, Co-borrowers, Guarantors ,Loans, Securities, Outstanding dues, Demand Notice sent under section 13(2) and Amount claimed there under are given below:

1. Borrower and Co-Borrowers: 1. PINKESH SURESHBHAI PATEL 2. HEMAL SURESHBHAI PATEL 3. ARCHANABEN HEMALBHAI PATEL 4. SHITAL PINKESH PATEL 5. RAVANI INFRASTRUCTURES 6. JYOTIBEN SURESHBHAI PATEL, All r/o at (a) Plot no 41-42 Shajdham Row house, Honey Park Road, Near Parsuram Garden, Adajan, Surat- 395009 (b) 91 Royal Trade Center Opposite Star Bazar Mall Hazira Road Surat 395009 2) Loan Account Number: 4556162, 1572921, 1573013 and 2336451 **3) Loan Amount in INR:** 1. Rs 10000000 (Rupees One Crore Only) with Loan No. 4556162 2. Rs 22909200 (Rupees Two Crore Twenty Nine Lakh Nine Thousand Two hundred Only) with Loan No. 1572921 3. Rs 13472353 (Rupees One Crore Thirty Four Lakh Seventy Two Thousand Three Hundred Fifty Three Only) with Loan No. 1573013 4. Rs 11000000 (Rupees One Crore Ten Lakh Only) with Loan No. 2336451 **4) Detail description of the Security: Mortgage** Property: - P1. ALL THE PIECE AND PARCEL OF PLOT NO A/66 PATEL NAGAR, R S NO. 20, BLOCK NO. 30, T P NO. 35 AHANGIRPURA PISAD SURAT 395009 admeasuring 46.82 Sq. Mtrs along with 12.18 Sq. Mtrs. P2. ALL THE PIECE AND PARCEL OF OFFICE NO 915 ROYAL TRADE CENTER, R S NO. 656/2 , T P S NO. 10(ADAJAN) AND R S NO. 658/2, MOJE ADAJAN SURAT 395009 admeasuring 208.19 Sq. Mtrs super built up area & 122.74 Sq. Mtrs Carpet Area along with 58.27 Sq. Mtrs. P3. ALL THE PIECE AND PARCEL OF UNIT NO 104, WOOD SQUARE R S NO. 66, T P S NO. 31, F P NO. 127, MOJE ADAJAN SURAT 395009 admeasuring 1816 Sq. ft. and 1022.95 Sq. ft and 999 Sq. ft. carpet area along with undivided share. P4. ALL THE PIECE AND PARCEL OF FLAT NO. 1101, 11TH FLOOR, RAJHANS ELITA TOWER-A, R S NO 361, 416, T P S NO- 14(PAL), F P 132, 134 & 177 PAIKL F P NO. 133, SURAT, 395009 admeasuring 3575 Sq. ft. and 196.34 Sq. Mtrs along with 88.53 Sq. Mtrs. P5. ALL THE PIECE AND PARCEL OF PLOT NO 42 SAHAJDHAM ROW HOUSE ADAJAN SURAT 395009 admeasuring 80.46 Sq. Mtrs. P6. ALL THE PIECE AND PARCEL OF AWAS NO 41, 41/A SAHAJDHAM ROW HOUSE, ADAJAN SURAT 395009 admeasuring 72.32 Sq. Mtrs. **5) Demand Notice Date:** 24TH OCTOBER 2019 **6) Amount due in INR:** Rs 44053614 (Four Crore Forty Lakhs Fifty Three Thousand Six Hundred Fourteen Only) as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and

2. Borrower and Co-Borrowers: 1. JAGDAMBA CORPORATION 2. SANGNA CORPORATION 3. PRAKASHBHAI CHHOTALAL THAKKAR 4. USHABEN PRAKASHBHAI THAKKAR 5. PRATIK P THAKKAR All r/o at (a) Serway No. 61, Plot No. B/27, Rameshwari Industries Estate Ved Road Surat 395004. (b) Plot No. 27/B, West part Rameshwar Indu Bhari Mata road Ved Road Surat 395004 (c) Plot No. 12/B, West part Rameshwar Indu Bhari Mata road, Ved Road Surat 395004 **2) Loan** Account Number: 1435343, 1460017, 2669181 and 2579182 3) Loan Amount in INR: 1. Rs 19700000 (Rupees One Crore Ninty Seven Lakh Only) with Loan No. 1435343 2. Rs 10200000 (Rupees One Crore Two Lakh Only) with Loan No. 1460017 3. Rs 1415000 (Rupees Fourteen Lakh Fifteen Thousand Only) with Loan No. 2669181 4. Rs 15385000 (Rupees One Crore Fifty Three Lakh Eighty Five Thousand Only) with Loan No. 2579182 4) Detail description of the Security: Mortgage Property:- (A) ALL THE PIECE AND PARCEL OF SHOP NO F-3, 1ST FLOOR, VASTU PUJYA RESIDENCY A-BUILDING OPP TRINITY L P SAVANI ROAD ADAJAN SURAT 395009 admeasuring 2177 Sq. ft i.e. 202.31 Sq. Mtrs Carpet Area (B) ALL THE PIECE AND PARCEL OF UNIT NO. 12, UPVAN CO OP HOUSING SOC NEAR SAHAJ SUPER SOTRE HANY PARK ADAJAN SURAT 395009 admeasuring 103.30 Sq. Mtrs (C) ALL THE PIECE AND PARCEL OF PLOT NO. 31, ROYAL BUNGLOWS OPP SHREE LAXMI BUNGLOWS UDHAN MAGDALLA ROAD VESU SURAT 395009 admeasuring 135.45 Sq. Mtrs Along with 2921 Sq. Fts i.e. 271.37 Sq. Mtrs 5) Demand Notice Date: 31st October 2019 6) Amount due in INR: Rs 37631141 (Rupees Three Crore Seventy Six Lakhs Thirty One Thousand One Hundred Forty One Only) as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses,

3. Borrower and Co-Borrowers: 1. SHREEJI ART 2. MUKESH KUMAR V TALAVIYA 3. GEETABEN TALAVIYA 4. YOGESHBHAI VASHARAMBHAI TALAVIYA 5. HETAL YOGESH TALAVIYA All r/o at (a) 346 Varsha Society matawadi, L H Road, Surat 395010. (b) 1 Ratnasagar society, SMC Party plot, kapodara Varachha road, Surat 395006 2) Loan Account Number: 2720538 3) Loan Amount in INR: 1. Rs 14188000 (Rupees One Crore forty One Lakh Eighty Eight Thousand Only) with Loan No. 2720538 4) Detail description of the Security: Mortgage Property:- (A) ALL THE PIECE AND PARCEL OF SUB PLOT NO. 1, RATANSAGAR SOC, NR. SMC PARTY PLOTAND MAHAGUJARAT SHOPPING CENTER SURAT 395006 admeasuring 1476 Sq. ft 5) Demand Notice Date: 31st October 2019 6) Amount due in INR: Rs 14297635 (Runees One Crore Forty Two Lakhs Ninety Seven Thousand Six Hundred Thirty Five Only) as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc as of 16th October 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc.

4. Borrower and Co-Borrowers: 1. ARJAN AGENCIES 2. NAMRATA HEMANT ISRRANI 3. BACHUMAL KODUMAL ISRRANI 4. HEMANT BACHUMAL ISRRANI All r/o at (a) GROUND FLOOR, PLOT NO. 86SECTOR 1/A, GANDHIDHAM-370201. (b) Plot No. 58, wARD 10, BC GANDHIDHAM 370201 2) Loan Account Number: 3774135 3) Loan Amount in INR: 1. Rs 11800000 (Rupees One Crore Eighteen Lakh Only) with Loan No. 3774135 4) Detail description of the Security: Mortgage Property:- (A) ALL THE PIECE AND PARCEL OF PLOT 58, WARD 10 BC GANDHIDHAM admeasuring 3175 Sq. ft 5) Demand Notice Date: 31st October 2019 6) Amount due in INR: Rs 12206263 (Rupees One Crore Twenty Two Lakhs Six Thousand Two Hundred Sixty Three Only) as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc as of 16th October, 2019 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc.

1. The Borrower and Co-Borrowers/Guarantors are called upon to make payment of the above mentioned demanded amount with further interest as mentioned herein above in full within 60 days of this notice failing which the Undersigned Authourised Officer of HDBFS shall be constrained to take action under the Act to enforce the above mentioned securities. Please note that, as per section 13(13) of the said Act 2. Mortgagers are restrained from

transferring the above-referred securities by way of sale, lease, Leave & License or otherwise without the consent of HDBFS. 3. For any query or Full and Final Settlement, Please Contact: Mr. Jignesh Dave 7043042298, Authorised Officer or Girraj Parashar Mobile No. 7600009388 HDB Financial Services Limited. Date: November 14, 2019

Place: Surat

શું તમે લગ્ન કરવા ખરેખર તૈયાર છો, MX પ્લેયર્સની શાદી ફીટનો પ્રશ્ન

અમદાવાદઃ દેશભરમાં લગ્નની ઘંટીઓ વાગી રહી છે! નવોઢાઓ અને વરરરાજાઓના પરિવારો તેમની જિંદગીના અત્યંત અગત્યના દિવસ માટેની ગોઠવણી કરવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ દરેક જણાવ જ્યારે સફળ લગ્ન માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સ્ઠ પ્લેયરનો નવો શો 'શાદી ફીટ' તમને એ પ્રતીતી કરાવવા આવી રહ્યો છે કે લગ્નને સફળ બનાવવાનું ચૂકશો નહી! કારણ કે સ્તરોએ દંપતી વચ્ચે સુસંગતતાનું આપણે દરેક જાણીએ છીએ કે એવા ઘણા માની ન શકાય તેવા વિચારો અને પરિબળો છે જે લગ્ન થવા દે છે અને તાજેતરની રિયાલિટી સિરીઝ સ્ઠ તોડી નાખે છે. બન્ને ભાગીદારોએ અનેક પ્રકારના સમાધાનો અને બલિદાનો



નિર્ધારણ કરે છે. આ બાબત પર ભાર મુકતા અને વધુમાં MX પ્લેયરની ઓરિજીનલ 'શાદી ફીટ' યોગ્ય લગ્ન કરવા માટેની દરેક બાબતો પર ભાર મુકે કરવાની જરૂર પડે છે આખરે વિવિધ અને સાચા પ્રશ્નો ઊભા કરે છે. (૧૯-૮)

એઆઈસીએફ ઈન્ટરનેશનલ વુમન ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબીન ચેસ ટુર્નામેન્ટ-૨૦૧૯



આયોજના ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા કરવામાં આવ્યં છે. બીજા રાઉન્ડનાં અંતે ભારતની પ્રિયંકા કે (રેટીંગ ૨૦૬૭) ૨ પોઈન્ટ કે ૨ પોઈન્ટ સાથે પ્રથમ સાથે રહી હતી સાથે ટુર્નામેન્ટમાં સરસાઈ ભોગવી જયારે બેબી ઓલ્ગા (યુક્રેન) અને રહી છે. પ્રિયંકાએ ભારતની જ એક લ્યુન્ગ ફોંગ હેન (વિયેતનામ)ની અન્ય ખેલાડી તનીશ્કા કોટીયાને બીજા રાઉન્ડમાં હરાવી આ સિધ્ધી ૧.૫ પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા હાંસલ કરેલ છે. ટુર્નામેન્ટના ત્રીજા ક્રમે રહી હતી. તા.૧૮-૧૧-રાઉન્ડમાં પ્રિયંકા કે નો મુકાબલો વિયેતનામની ખેલાડી ન્યુલ થાઈ માઈ સાથે થશે. જયારે ટેબલ નં.૬માં ઈનામો વહેંચાવમાં આવશે.★

અમદાવાદ: ઉપરોક્ત ટુર્નામેન્ટનું ભારતની આકાંક્ષા હગવાને અને વિયેતનામની ખેલાડી લ્યુન્ગ ફોંગ હેન વચ્ચેની મેચ ડ્રોમાં પરીણમી હતી. બીજા રાઉન્ડના અંતે ભારતની પ્રિયંકા ખેલાડીઓ અનુક્રમે ૨ પોઈન્ટ અને ૨૦૧૯ના રોજ પુરી થનારી આ ટુર્નામેન્ટમાં કુલ રૂા.૧૦ લાખના રોકડ

પ્રવેશોત્સવઃ વિદ્યાર્થિનીઓને અપાતી સાઈકલના વેચાણથી વિવાદ



ગાંધીનગર, શિક્ષણની ગુણવત્તા સુધારવાની સાથે સ્કૂલે જતાં બાળકોનો ઉત્સાહ વધારવા માટેના પ્રયાસો અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ માટે ખરીદેલી સાઈકલનું ગાંધીનગરમાં વેચાણ થતા વિવાદ સર્જાયો ગુજરાત સરકાર લખેલી એક સાયકલનું વેચાણ થયુ હતું. સેક્ટર-૧૩-સી ખાતે કરશે.

ચલાવતા દશરથભાઈ વી. પટેલ મંગળવારે સવારે સાઈકલ ખરીદવા માટે ગયા હતા. તેમણે સેકટર-૨૨માં આવેલા વિપુલ સાઇકલ સ્ટોર પરથી રૂ.૩૫૦૦ની કિંમતમાં એક સાઈકલ ખરીદી હતી. સાઈકલ પર શાળા પ્રવેશોત્સવ-૨૦૧૯ લખેલું હતું. સરકારી યોજનાનું નામ અને લોગો સાથેની આ સાઈકલ ખુલ્લા બજારમાં વેચાતા કાળા બજાર થતા હોવાની તથા સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની લાભાર્થીઓને વંચિત રાખવાના કૌભાંડની આશંકા પ્રબળ બની છે. જો કે કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા ધો-૯માં સ્ટોરના સંચાલકે આવી આશંકાને અભ્યાસ કરતી બક્ષીપંચ તથા આર્થિક ફગાવી દેતા દલીલ કરી હતી કે, પછાત જ્ઞાતિની વિદ્યાર્થિનીઓને સાયલક સેમ્પલમાં આવેલી સાઈકલનું તેમણે અર્પણ કરવામાં આવે છે. સરકારે વેચાણ કર્યુ હતું. સેમ્પલની સાઈકલ વેચવાનું ગેરકાયદે ન હોવની સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે છે. સેક્ટર-૨૨ ખાતે આવેલા સાઈકલ આવી ૪૮ સાઈકલ તૈયાર છે. શાળાઓ સ્ટોર પરથી શાળા પ્રવેશોત્સવ-૨૦૧૯, શરૂ થતાની સાથે આ તમામ સાઈકલ વેરાવળ વેરાવળ જિલ્લામાં પહોંચતી

થરાદના ઝેટામાં નકળંગ મંદિરની દાનપેટી તોડવાનો નિષ્ફળ પ્રયાસ

નકળંગ મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. ચાર દિવસ પહેલા રાત્રિના સુમારે બે તસ્કરો ચોરી કરવાના ઈરાદે ઘુસી આવ્યા હતા અને પ્રવેશ કરી દાનપેટી તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે તેમાં સફળતા નહી મળતા બંને જણા નાસી છુટયા હતા. બીજા દિવસે સવારે સવારમાં પુજા કરવા આવેલા હિતેશભાઈ પુજારીને તાળું તૂટેલું જણાતાં આ બનાવની તેમણે ટ્રસ્ટીઓ ખાનાભાઈ પટેલ તથા રમેશભાઈ પટેલ સહિત ગામના અત્રણીઓને વાત કરી હતી. આથી બધા એકઠા થઇ તપાસ કરતાં મંદિરમાં કોઇ પણ પ્રકારની ચોરી થવા પામી ન હોવાનું જાણવા મળ્યું હતું. વધ તપાસ કરતાં મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પેન્ટ શર્ટ પહેરેલા બે શખ્સો ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા નજરે ચડ્યા હતા. આ અંગે ગ્રામજનો પૈકી આગેવાનોએ પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ઘટનાની



તપાસ કરવાની લેખિતમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં સીસીટીવી ઉપરાંત ચોકીદાર પણ રાખવામાં આવેલ છે. રાત્રિના સુમારે ચોકીદાર દ્વારા અનાયાસે ઉધરસ ખાતાં તસ્કરો નાસી છુટયો હોવાનું બહોળી સંખ્યામાં એકઠા થયેલા અનુમાન વ્યક્ત કરાયું હતું. જેને નકળંગ મહારાજનો ચમત્કાર પણ લોકો

જણાવતા હતા.

ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયા લૂટવાના પરવાના આપતી ભાજપ સંરકાર

ખેડુતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કદરતી આપત્તીનો સતત ખેડતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાની, સેટેલાઈટ સર્વે, ડેટાબેંક, ફરીયાદ માટે પોર્ટલ સહિતની તમામ બાબતો માટે એમનેક્ષ ઈન્ફ્રો ટેકનોલોજી અને હિટાચી ઇન્ડિયાના સંયક્ત ભાગીદારીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે, છેલ્લા બે મહિનાથી ખેડૂતોને, ઓછા વરસાદ, અતિ વરસાદ અને કમોસમી વરસાદમાં પાકની નુકસાની અંગે સર્વેના નામે ભાજપ સરકાર, ખાનગી વીમા કંપની, કૃષિ વિભાગ ચલક ચલાણું ૨મી રહી છે જેૅનાથી ખેડૂતો ભારે આર્થિક નુકસાનીમાં સપડાયા છે. એમનેક્ષ ઈન્ફ્રો ટેકનોલોજી ભાજપના મોટા નેતાની પુત્રીની કંપનીને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની શરત મુજબ ખેડૂતોના હિતમાં પાક નુકસાની વિગતો કૃષિ વિભાગમાં તૈયાર હોવા છતાં ભાજપ સરકાર – કૃષિ વિભાગની આપદા – કસોમસી વરસાદનો ભોગ બનેલ ખેડુતોને શા માટે સીધુ વળતર ચુકવવામાં વિલંબ કરી રહી છે? તેનો જવાબ માંગતા

અમદાવાદઃ ગુજરાતના ૪૯ લાખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,

SPECIALITY PAPERS LTD

						Rs.in Lakh	
Sr. n	Quarter Ended			Half Year Ended		Year Ended	
Particulars No	30/09/2019 (Unaudited)	30/06/2019 (Unaudited)	30/09/2018 (Unaudited)		30/09/2018 (Unaudited)	31.03.201 (Audited	
1. Income		014 000	410 700	044.400	470 400	4 470 00	
(a) Revenue from Operations	599.276	241.920	449.730	841.198		1,472.23	
(b) Other Income	500.070	044.000	0.001	044 400	0.563	243.42	
TOTAL INCOME (A + B)	599.276	241.920	449.731	841.198	474.062	1,715.65	
2. EXPENSES							
Cost of sales and other operational							
expenses	004 550	0.47 500		040.000	407 770	4 504 00	
Purchase of Stock of trade	601.553					1,591.90	
Changes in Inventories	(2.506)		(5.141)			(105.26	
Employee Benefit Expenses	1.531	4.230	1.161	5.761	2.014	5.47	
Depreciation and Amortization	0.114		2.272			6.92	
Expenses	3.350					258.34	
Other Expenses	604.041	257.332	464.238	861.383	495.863	1,757.37	
TOTAL EXPENSES							
3. Profit/ (Loss) Exceptional items &							
Taxes (1-2)	(4.765)	(15.412)	(14.507)	(20.185)	(21.801)	(41.72)	
Exceptional Items							
5. Profit/ (Loss) before tax (3-4)	(4.765)	(15.412)	(14.507)	(20.185)	(21.801)	(41.72)	
6. Tax Expense							
Current Tax	-	-		-			
Deferred Tax	-	-	(253.046)		(253.046)	(350.10	
7. Profit/(Loss) for the period (5-6)	(4.765)	(15.412)	238.539	(20.185)		308.38	
8. Other Other comprehensive income	-	-	226.178	-	226.178	(204.69	
i.ltems that will not be reclassified							
to profit or loss							
ii.Income tax relating to Items that			58.241	-	58.241	52.71	
will not be reclassified to profit or los	\$ -	-	167.937	-	167.937	(151.98	
Total Compresive Income							
(Net of Taxes)	-						
9. Total Compresive Income 7+8	(4.765)	(15.412)	406.476	(20.185)	399.182	156.40	
¹⁰ Paid up Shares Capital Values 10							
Per Shares	15,616.410	15,616.410	15,616.410	15,616.410	15,616.410	15,616.41	
11.Earnings per Equity Share							
-Basic	(0.000)		0.026			0.02	
-Diluted	(0.000)	(0.001)	0.026	(0.001)	0.026	0.02	

at Board Meeting held on 11/11/19 Previous year figure have been regrouped/ rearranged wherever necessary

Hawa Engineers (td.

Registered office : Plot No. 129, Narol Road, Near Kashiram Textile Mill ,Ahmedabad ,Gujarat ,382405 Email: cs@hawaengltd.com II Website: www.hawaengltd.com II" II Phone: 079-25320781, 25320782 II CIN: L29120GJ1993PLC019199 II"

(Rs. in lakh except per share data						
Sr. No.	Particulars	Quarter ended	Half Year ended	Year Ended		
		30-09-2019	30-09-2019	31-03-2019		
		UnAudited	UnAudited	Audited		
1	Total income from operations (net)	1006.59	2329.91	5095.98		
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	33.61	73.54	104.72		
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	33.61	73.54	104.72		
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	33.61	73.54	73.56		
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	33.61	73.54	73.56		
6	Equity Share Capital	352.64	352.64	352.64		
7	Other Equity(excluding Revaluation Reserve)	0.00	0.00	963.19		
8	Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) Basic & Diluted	0.95	2.09	2.09		

The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the Company in its meeting held on 13/11/2019 and same are also been reviewed by the statutory auditors of the Compan

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites(www.bseindia.com) and on the Company website(www.hawaengltd.com)

	DIN:00006879
Date : 13th November, 2019	Managing Director
Place : Ahmedabad	Aslam F Kagdi
	Sd/-
	For, Hawa Engineers Ltd



SUNGOLD CAPITAL LTD

[CIN: L65910GJ1993PLC018956] Regd off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla Narmada - 393145. Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn,

Malad (west), Mumbai - 400064 Website: www.sungoldcapitallimited.com Email: info@sungoldcapitallimited.com

	(Rs. In Lakhs, except per share data					
Sr.	Particulars	Quarter ended	Year to date Figures/Previous	Corresponding Three months		
			Year ending	ended in the previous year		
		30-09-2019	31-03-2019	30-09-2018		
		Unaudited	Audited	Unaudited		
1	Total Income from Operations	57.851	185.199	48.732		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	1.909	4.757	4.239		
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items#)	1.909	4.757	4.239		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	1.413	3.573	2.929		
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1.413	3.573	2.929		
6	Equity Share Capital (Face value of Rs. 10/-)	1840.350	1840.350	1840.350		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	354.879	-		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
	(a) Basic	0.008	0.019	0.016		
	(b) Diluted	0.008	0.019	0.016		

The above result is reviewed by the Audit Committee at the meeting and approved by the Board of Directors at their meeting held on Tuesday November 12, 2019. The above is an extract of the detailed format of financial result filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, and 2015. The full format of Financial Result is available on Stock Exchange website www.bseindia.com and on Company's website, www.sungoldcapitallimited.com.

The Company has three reportable segments which are NBFC, Entertainment and software development. For Sungold Capital Limited

Place: Mumbai Date: 12.11.2019 Rajiv Kotia (Chairman & Managing Director) DIN: 00135912

Corrigendum

Please refer to the Statement of Unaudited Financial Results (Standalone & Consolidated) for the quarter and half year ended 30th September, 2019 of Texel Industries Limited (CIN: L29100GJ1989PLC012576) published in Lokmitra on **November 13, 2019,** pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015,

Kindly note that the place of signing the above mentioned Financial Results has been inadvertently mentioned as Mumbai, Ahmedabad in the aforementioned publication in place of Ahmedabad, due to printing error of the publisher.

VIVANTA INDUSTRIES LIMITED

Regd. Office: 403, Sarthik 2, Opp. Rajpath Club, S. G. Highway, Ahmedabad 380054 CIN: U74110GJ2013PLC075393

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED

SEPTEMBER 30, 2019.					
			(Rs. In Lacs)		
Particulars	Quarter ending	Year to date Figures	Correspondin g 3 months ended in the previous year		
	30/09/2019	30/09/2019	30/09/2018		
	Unaudited	Unaudited	Unaudited		
Total income from operations	0.00	0.00	39.91		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional					
and/or Extraordinary items)	-13.35	-23.74	-0.83		
Net Profit / (Loss) for the period before tax (after					
Exceptional and/or Extraordinary items)	-13.35	-23.74	-0.83		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional					
and/or Extraordinary items)	-13.35	-23.74	-0.83		
Total Comprehensive Income for the period [Comprising					
profit / (Loss) for the period (after tax) and other					
comprehensive income (after tax)]	-13.35	-23.74	-0.83		
Equity Share Capital	1000.00	1000.00	1000.00		
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)					
Basic :	-0.13	-0.24	-0.01		
Diluted:	-0.13	-0.24	-0.01		
Earnings Per Share (after extraordinary items) (of		***************************************			
Rs. 10/- each) (not annualised)					
Basic :					
Diluted :	-0.13	-0.24	-0.01		
Diluted :	-0.13	-0.24	-0.01		
Notes:		anti (la fina di Papa) la man'i Primahand di Primahanda di La Bahaman'i Annahadina Ann	gaan hiribir lah basakara sa		

ુકુદરતી આફતો સામેની નુકસાની માટે

વીમા કંપનીઓ દ્વારા વીમા કવચ માટે

ખેડતો પાસેથી મોટ્ર પ્રિમીયમ વસુલ

કરવામાં આવે છે. 🖈

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www. seindia.com) and the company's website (www. vivataindustries.com)

For, VIVANTA INDUSTRIES LIMITED SD/ PARIKH H.A. Date: 12/11/2019 MANAGING DIRECTOR DIN:00027820 Place: Ahmedabad

HDB FINANCIAL એચડીબી ફાઇનાન્સીયાલ સર્વીસીસ લીમીટેડ

રજીસ્ટર ઓફ્રીસ રાઘીકા, બીજે માળે,લો ગાર્ડન રોડ નવરંગપુરા અમદાવાદ ગુજરાત પીનન્કોડ ૩૮૦૦૦૯ શાખા કચેરી-૬૦૩,૨૧ સેન્ચુરી બીલ્ડીંગ,રીંગ રોડ સુરત, ગુજરાત પીન ૩૯૫૦૦૫

સરફેસી એક્ટ, ૨૦૦૨ના અનુચ્છેદ૧૩(૨) અંતર્ગત

નીચે દર્શાવેલા કરજદાર, સહકરજદાર અને જામીનદારો એ એચડીબી ફાયનાન્સીયલ સર્વસિઝ લીમીટેડ સુરત શાખા અને ગાાંધીધામ શાખામાંથી સ્થાવર ીલકત ગીરો ોમકીને લોન લીધી હતી. અને તમે તમારા, નાણાંકીય વ્યવહારો યોગ્ય રીતે કર્યયા નથી અને તેના નાણા પરત ચકવવામાં તેમે કસર કર્ય દ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ સાથ અનુક્રમે તમારી લોન નોન પરફોમ એસેટ તરીકે ગણવામાાં આવી છે.તેની સાથે ગીરો મિલકત આ બાકી નાણાંની વસુલાત માટે ઉફયોગી થઈ શકે છે. એચડીબીએફએસ ને બાકી લેણાની વસલાત માટે નો અધિકાર છે સિક્યોરાઇજેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ એન્ડ એન્કોર્સમેન્ટ એક્ટ ૨૦૦૨ (ધ એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળ માંગણાં નોટીસ આપી છે તે નોટીસની બાબતો આ કાયદાાની કલમ (૧૩(૨) હેઠળ અહી પ્રકાશીત કરવામાં આવી છે. સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોરસમેન્ટ) નિયમ ૨૩૦૦૨ અને તેના વિકલ્પના રસ્તાઓ તમારા માટે ઉપયોગ કરાશે કરજદાર, સહ- કરજદાર, જામીનદારો, લોન, સિક્યોરીટીઝ, બાકી લેણા, માંગણા નોટીસ આ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ દાવીની રકમ અહી નીચે

૧. કરજદાર અને સહકરજદારઃ ૧ પિન્કેશ સુરેશ ભાઈ પટેલ ૨. હેમલ સુરેશભાઈ પટેલ ૩. અર્ચનાબેન હેમલભાઈ પટેલ ૪. શીતલ પિન્કેશ પટેલ, પ હ્વાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરર્સ, ∉. જ્યોતિબેન સુરેશભાઈ પટેલ તમામ રેસીડેન્ટ એટ્ર (એ) પ્લોટો નં. ૪૧-૪૨ શાજધાામ રો હાઉસ, હની પાર્ક રોડ પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ સુરત-૩૯૫૦૦૯(બી) ૯૧ રોયલ ટ્રેડ સેન્ટર સ્ટાર બઝાર મોલ સામે,હઝીરા રોડ, સુરત-૩૯૫૦૦૯ ૨) લોન એકાઉન્ટ નંબરઃ ૪૫૫૬૧૬૨,૧૫૭૨૯૨૧,૧૫૭૩૦૧૩ અને ૨૩૩૬૪૫૧ ૩) લોન ૨કમમાં આઈએનઆર: રૂા.૧૦૦૦૦૦૦, (રૂપિયા એક કરોડ પુરા) લોન નંબર સાથે. ૪૫૫૬૧૬૨ ૨. રૂા.૨૨૯૦૯૨૦૦ (રૂપિયા. બે કરોડ ઓગણત્રીસ લાખ નઉ હજાર બસો પુરા) લોન નંબર .૧૫૭૨૯૨૧ ૩. રૂા. ૧૩૪૭૨૩૫૩ (રૂપિયા એક કરોડ ચોત્રીસ લાખ બોતેર હજારત્રણ સો ત્રેપન પુરા) સાથે લોન નંબર૧૫૭૩૦૧૩૪ રૂા. ૧૧૦૦૦૦૦૦ (રૂપિયા એક કોરડ દસ લાખ પુરા) લોન નંબરઃ૨૩૩૬૪૫૧ **૪. ગિરો મુકેલ આરિક્ષત મિલકતની વિગતઃ**- પી૧, તમામ ભાગ અને હિસ્સો ઓફ પ્લોટ નં. એ/૬૬ પટેલ નગર. આરએસ્ ાં.૨૦, બ્લોક નં.૩૦, ટી પી.નં.૩૫, જહાંગીરપુરા પીસદ સુરત ૩૯૫૦૦૯ માપ ૪૬.૮૨ સ્કેવર મીટર્સ સાથે અલગ થી૧૨.૮૮ સ્કેવર મી.. **પી૨** તમામ ભાગ અનેહિસ્સો ઓફ ઓફિસ નં.૯૧૫ રોયલ ટ્રેડ સેન્ટર, આર.એસ.નં. ૬૫૬//૨, ટીપીએસનં. ૧૦ (અડાજશ) અને આરએસ નં. ૬૫૮/૨, મૌજે અડાજણ, સુરત-૩૯૫૦૦૯ માપ ૨૦૮.૧૯ સ્કેવર મી. સુપર બિલ્ટ અપ એરિયા અને ૧૨૨.૭૪ સ્કેવર મી. કારપેટ એરિયા અલગ થીપ૮.૨૭ સ્કેવર મી.. **પી૩.** તમામ ભાગ અને હિસ્સો ઓફ યુનિટ નં. ૧૦૪, વુડ સ્કેવર આરએસ નં. ૬૬, ટીપીએસ નં. ૩૧, એફ પી નં.૧૨૭, મૌજે અડાજઘ, સુરત ૩૯૫૦૦૯ માપ ૧૮૧૬ સ્કેવર ફીટ અને ૧૦૨૨.૯૫ સ્કેવર ફીટ. અન ૯૯૯ સ્કેવર ફીટ કારપેટ એરિયા સાથે અનિડવાઈડેડ શેર. પી૪, તમામ ભાગ અને હિસ્સો ક્લેટ નં. ૧૧૦૧, ૧૧મો માળ, રાજહંસ એલાઇટ ટાવર-૧, આર એસ નં. ૩૬૧,૪૦૬, ટીપીએસ નં. -૧૪ (પાલ), એકપી ૧૩૨, ૧૩૪ અને ૧૭૭ પૈકી એફપી નં. ૧૩૩, સરત, ૩૯૫૦૦૯ માપ ૩૫૭૫ સ્કેવર ફ્રીટ અને ૧૯૬.૩૪ સ્કેવરમી. અલગ થી ૮૮.૫૩ સ્કેવર મી.. પીપ તમામ ભાગ અને હિસ્સો પ્લોટ નં. ૪૨ સહજધામ રો હાઉસ અડાજણ સુરત ૩૯૫૦૦૯ માપ ૮૦.૪૬ સ્કેવર મી. પી૬. તમામ ભાગ અને હિસ્સો ઓફ આવાસ નં. ૪૧, ૪૧/એ સહજધામ રો હાાઉસ અડાજણ સુરત ૩૯૫૦૦૯ માપ ૭૨.૩૨ સ્કેવર મી. ૫) માંગણા નોટીસ ની તારીખ :૨૪મી ઓક્ટોબર, ૨૦૧૯ ૮) દયય રકમ આઈએનઆરમાં : રૂા. ૪૪૦૫૩૬૧૪ (ચાર કરોડ ચાલીશ લાખ ત્રેપન હજારછસો ચોદ પુરા) જે ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ અને ભાવી વ્યાજ સાથે વધારાના ખર્ચા, કોસ્ટ અને ચાર્જ વગદેરે સાથે ૧૬મી ઓક્ટોબર, ૨૦૧૯ અને ભાવી વ્યાજ સાથે વધારાના ખર્ચા, કોસ્ટ અને ચાર્જ વગેરે સાથે. **૨. કરજદાર અને સહ- કરજદારઃ ૧.** જગદમ્બા કોરપોરેશન ૨. સંગના કોરપોરેશન ૩. પ્રકાશભાઈ છોટાલાલ ઠક્કર ૪. ઉપાબેન પ્રકાશભાઈ ઠક્કર ૫ પ્રતિક પી ઠક્કર તમામ રહેવાસી એટ્ (એ)સર્વે નં. ૬૧, પ્લોટ નં. બહી/૨૭, રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વેદ રોડ સુરત- ૩૯૫૦૦૪. બી) પ્લોટ નં ૨૭/બી, વેસ્ટ પાર્ટ રામેશ્વર ઇંદુભરી માતા સોોડવેદ રોડ, સુરત ૩૯૫૦૦૪. (સી) પ્લોટ નં. ૧૨//બી, વેસ્ટ પાર્ટ, રામેશ્વર ઇંદુ ભારી માતા રોડ, વેદ રોડ સુરત ૩૯૫૦૦૪ ૨) લોન એકાઉન્ટ નંબર:૧૪૩૫૩૪૩,૧૪૬૦૦૧૭, ૨૬૬૯૧૮૧ અને ૨૫૭૯૧૮૨ ૩) લોન ૨કમ આઈએનઆર : ૧. ૨રૂા ૧૯૭૦૦૦૦૦ (રૂપિયા એક કોરડ સતાણું લાખ પુરા) સાથે લોન નં.૧૪૩૫૩૪૩ ૨. રૂા. ૧૦૨૦૦૦૦૦ (રૂપિયા એક કોરડ બે લાખ પુરા) સાથે લોન નં. ૧૪૬૦૦૦૭ ૩ . રૂ. ૧૪૧૫૦૦૦ (રૂપિયા ચૌદ લાખ પન્દર હજાર પુરા) સાથે લાન નં. ૨૬૬૯૧૮૧ ૪. રૂા. ૧૫૩૮૫૦૦૦ (રૂડપિયા એક કોરડ ત્રૈપન લાખ પંચ્યાસી હજાર પુરા) સાથે લોન નં. ૨૬૬૯૧૮૧ ૪. રૂા. ૧૫૩૮૫૦૦૦ (રૂપિયા એક કરોડ ત્રૈપન લાખ પંચ્યાસી હજાર પુરા)સાથે લોન નં ૨૫૭૯૧૮૨ .**૪) ગરો મુકેલ આરિક્ષત મિલકતની વિગત** : એ)તમામ ભાગ અને હિસ્સો શોપ નં . એફ-૩, ૧લો માળ, વાસ્તુ પુજય રેસીડેન્શી એ-બિલ્ડિંગ ત્રિનીટી સામે, એલ પી સેવાણી રોડ અડાજણ સુરત ૩૯૫૦૦૯ માપ ૨૧૭૭ સ્કેવર મી.જેમકે ૨૦૨.૩૧ સ્કેવર મી. કારપેટ એરિયા (બી) તમામ ભાગ અને હિસ્સો ઓફ યુનિટ નં. ૧૨, ઉપવન કો ઓપ હાઉસિંગ સોસ. સહજ સુપર સોટરે હની પાર્ક પાસે, અડાજણ સુરત૩૯૫૦૦૯ માપ ૧૦૩.૩૦ સ્કેવર મી. (સી) તમામ ભાગ અને હિસ્સો પ્લોટો નં.૩૧, રોયલ બંગલોઝ શ્રુ લક્ષઅમી બંગલોઝ સામે, ઉધના મગદલ્લા રોોડ, વેસુ સુરત ૩૯૫૦૦૯ માપ ૧૩૫.૪૫ સ્કેવર મી. અલગ થી ૨૯૨૧ સ્કેવર ફી. જેમકે ૨૭૧.૩૭ સ્કેવર મી.૫) માંગણા નોટીસ તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ ૬) દેય રકમ આઈએનઆર : રૂા. ૩૭૬૩૧૧૪૧ (રૂપિયા ત્રણ કરોડ છોતેર લાખ એકત્રીસ હજાર એક સો એકતાલીસ પુરા) જે ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ અને ભાવી વ્યાજ સાથે વધારાના ખર્ચા, કોસ્ટ અને ચાર્જ વગદેરે સાથે છે.

૩. કરજદાર અને સહ- કરજદાર : ૧શ્રીજી આર્ટ ૨. મુકેશ કુમાર વી તલવિયા ૩. ગીતાબેન તલવિયા ૪. યોગેશભાઈ વશરામભાઈ તલવિયા ૫. હેતલ યોગેશ તલવિયા તમામ રહેવાસી એટ્ એ) ૩૪૬ વર્ષા સોસાયટી માતાવાડી, એલ એચ રોડ, સુરત ૩૯૫૦૧૦ બી) ૧ રત્ન સાગર સોસાયટી, એસએમએસ પાર્ટી પ્લોટ, કર્યોોડરા વરાચ્છા રોડ, સુરત ૩૯૫૦૦૬ ૨) લોન એન્કાઉન્ટ નંબર:૨૭૨૦૫૩૮ ૩) લોન ૨કમ આઈએનઆર : ૧. રૂા. ૧૪૧૮૮૦૦૦ ા રૂપિયા એક કરોડએકતાલીસ લાખ ઇઠ્ચાસી હજાર પુરા)લોન નં . ૨૭૨૦૫૩૮ માં **૪) ગિરો મુકેલ આરક્ષિત મિલકતની વિગત** : - એ) તમામ ભાગ અને . હિસ્સો ઓફ સબ પ્લેટ નં. ૧, રત્નસાગર સોસ. એસએમસી પાર્ટી પ્લોટ પાસ અને મહાગુજરાત શઓપિંગ સેન્ટર, સુરત ૩૯૫૦૦૬ માપ ૧૪૭૬ સ્કેવર ફ્રી. ૫) માંગણા નોટીસ તારીખ : ૩૧ ઓક્ટોબર,૨૦૧૯ ૬) બાકી રકમ આઈએનઆર : રૂા. ૧૪૨૯૭૬૩૫ (રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ સતાણું હજાર છસો પાંત્રીસ પુરા) જે ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ અને ભાવી વ્યાજ સાથે વધારાના ખર્ચા, કોસ્ટ અને ચાર્જ વગદેરે સાથે છે.

૪. કરજદાર અને સહ- કરજદારઃ૧. અરજન એજેન્સી ૨. નમૃતા હેમંત ઇસરાની ૩. બચુમલ કોદુમલ ઇસરાની૪. હેમંત વચુલાલ ઇસરાની તમામ રહેવાસી એટ્ () ગ્રાઉન્ડ ક્લોર, પ્લોટ નં. ૮૬ સેક્ટર ૧/એ, ગાંધીધામ- ૩૭૦૨૦૧. બી) પ્લોટ નં. ૫૮, વાર્ડ ૧૦, બીસી ગાંધીધામ ૩૭૦૨૦૧) લોન એકાઉન્ટ નંબરે : ૩૭૭૪૧૩૫ ૩) લોન રકમ આઈએનઆાર : ૧. રૂા.૧૧૮૦૦૦૦૦ (રૂપિયા એક કરોડ અડાર લાખ પુરા) લોન નં. ૩૭૭૪૧૩૫ ૪) **ગિરો મુકેલ આરક્ષિત મિલકતની વિગતઃ- એ)** તમામ ભાગ અને હિસ્સો ઓફ પ્લોટ નં. ૫૮, વાર્ડ ૧૦ બીસી ગાંધીધામ માપ ૩૧૭૫ સ્કેવર ફી.પ) માંગણા નોટીસ ની તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ ફ) બાકી રકમ આઈએનઆર : રૂા. ૧૨૨૦૬૨ફ૩ (રૂપિયા એક કરોડ બાવીસ લાખ છ હજાર બસો ત્રેસઠ પુરા)જે જે ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ અને ભાવી વ્યાજ સાથે વધારાના ખર્ચા, કોસ્ટ અને ચાર્જ વગદેરે સાથે છે.

૧. કરજદાર અને સહ- કરજદાર/જામીનદાર માંગણા નોટીસ કરજદારોને આપવામા આવી છે તેમની બાકી નીકળતી રકમ પરત કરી જવા માટે ની માહીતી બા નોટીસની ૨કમ સાથે તમામ કિમંત, ખર્ચ જયાં સુધી તે ચુકવાય નહી ત્યાં સુધી માટે આ નોટીસ મળ્યેથી ૬૦ દિવસની અંદર નાંણા ચુકવી જવ જશાવવામાં આવ્યું હતુ. જે હોય તે એચડીબીએફએસ ના અધિકૃત અધિકારીએ આ કહેવાતી મિલકત નો નિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કૃપયા યાન આપો કે આ કહેવાતા એક્ટ ના અનુચ્છેદ ૧૩(૧૩)ના ઁશરતો મૂજબ રેસટ્રેઇન્ડ થી ઉક્ત મિલકત ને તબદીલ અથવા વેચાણ , લીઝ, લીવ એન્ડ લાઇસેંસ ની કાર્યવાહી એચડીબીએફએસ થી સમ્પર્ક કર્યા વગર કરવી નહીં. ૩. કોઈ પણ ક્વેરી અથવા ફૂલ એન્ડ ફાયનલ સેટલમેંટ માટે કૃપયા : શ્રી જિગ્નેશ દવ ૭૦૪૩૦૪૨૨૯૮ અધિકૃત અધિકારી અથવા ગિરરાજ પરાશર મોબાઇલ નં. ૭૬૦૦૦૦૯૩૮૮ એચડીબી ફાયયનાન્સિયલ સર્વિસેઝ લીમીટેડનો સંપર્ક કરવો.

તારીખ : ૧૪ નવેમ્બર, ૨૦૧૯ સ્થળ : સુરત

એચડીબીએફએસ વતી

અધિકૃત અધિકારી